

27 સપ્ટેમ્બર 2018

સીટી ઓફ બ્રેમ્પટન ખાતે થેક્સગિવિંગ 2018

બ્રેમ્પટન, ઓન્ટારિયો – બ્રેમ્પટન સીટી હોલ સોમવાર, ઓક્ટોબર 8ના રોજ થેક્સગિવિંગ નિમિત્તે બંધ રહેશે. સીટીની ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ નહીં હશે અથવા ઘટાડેલા સેવા સ્તરે મળશે. આ સમય દરમિયાન નાગરિકો લગ્નના લાયસન્સની અરજી નહીં કરી શકશે, પાર્કિંગ ફી નહીં ભરી શકશે અથવા જાતે પરમીટ માટે અરજી કરી શકશે નહીં. ઓનલાઇન પસંદગીઓ માટે કૃપા કરી અહીં મુલાકાત લો

www.brampton.ca

ઘણી બધી સેવાઓ સામાન્યપણે ચાલુ રહેશે જેમાં સામેલ છે: આગ અને અગ્નિશમન સેવાઓ અને બાય-લો અમલીકરણ. સીટી ઓફ બ્રેમ્પટનના સેવા પરિવર્તનો અને બંધ થયેલ સેવાઓ વિશે વધુ માહિતી માટે 311 પર કોલ કરો અથવા www.brampton.caની મુલાકાત લેશો.

ટ્રાન્ઝિટ સેવાઓ

થેક્સગિવિંગના સપ્તાહના અંતે બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું સમયપત્રક આ મુજબ રહેશે:

- શુક્રવાર, ઓક્ટોબર 5: નિયમિત ચાલુ અઠવાડિયાની સેવા
- શનિવાર, ઓક્ટોબર 6: શનિવારની નિયમિત સેવા
- રવિવાર, ઓક્ટોબર 7: રવિવાર/રજાની સેવા
- સોમવાર, ઓક્ટોબર 8: રવિવાર/રજાની સેવા

સોમવાર, ઓક્ટોબર 8ના રોજ ટ્રાન્ઝિટ સ્ટોર્સ બંધ રહેશે.

રૂટ અને સમયપત્રકની માહિતી માટે, 905.874.2999 પર કોલ કરો અથવા www.bramptontransit.comની મુલાકાત લો અને વાસ્તવિક સમયની આગામી માહિતી માટે નેક્સ્ટ રાઇડ (Next Ride)નો ઉપયોગ કરો. પ્રવાસ કરતી વખતે સ્માર્ટફોન અથવા અન્ય મોબાઇલ ઉપકરણ પર આગામી બસની માહિતી nextridge.brampton.ca પર જુઓ.

મ્યુનિસિપલ ચુંટણી માટે એડવાન્સ વોટિંગ

ઓક્ટોબર 6 ને શનિવારે નીચેના મુકામે એડવાન્સ વોટિંગ હાથ ધરાશે:

- બ્રેમ્પટન સીટી હોલ, 2 વેલિંગ્ટન સ્ટ્રીટ પશ્ચિમ
(Brampton City Hall, 2 Wellington St W)

- ब्रॅम्पटन सॉकर सेंटर, 1495, सेंडलवुड पार्कवे पूर्व
(Brampton Soccer Centre, 1495 Sandalwood Pkwy E)
- केसि कॅम्पबेल कम्युनिटी सेंटर, 1050 सेंडलवुड पार्कवे पश्चिम
(Cassie Campbell Community Centre, 1050 Sandalwood Pkwy W)
- सेंच्युरी गार्डन्स रिक्लिअेशन सेंटर 340 वॉडन स्ट्रीट पूर्व
(Century Gardens Recreation Centre, 340 Vodden St E)
- डेविड सुजुकी सेकेंडरी स्कूल, 45 डेविसेम ड्राईव
(David Suzuki Secondary School, 45 Daviselm Dr)
- अर्न्सक्लिफ् रिक्लिअेशन सेंटर, 44 ईस्टबोर्न ड्राईव
(Earnscliffe Recreation Centre, 44 Eastbourne Dr)
- गोर मेडोज कम्युनिटी सेंटर, 10150 धी गोर रोड
(Gore Meadows Community Centre, 10150 The Gore Rd)
- ग्रीनब्रिअर रिक्लिअेशन सेंटर, 1100 सेंट्रल पार्क ड्राईव
(Greenbriar Recreation Centre, 1100 Central Park Dr)
- जम आर्चडेकिन रिक्लिअेशन सेंटर, 292 कोनेस्टोगा ड्राईव
(Jim Archdekin Recreation Centre, 292 Conestoga Dr)
- साउथ फ्लेचर स्पोर्ट्सप्लेक्स, 500 रे लॉसन ब्लूवेवर्ड
(South Fletcher's Sportsplex, 500 Ray Lawson Blvd)

मनोरंजननी सवलतो

मोटा भागनी मनोरंजननी सवलतो अेटवेके रिक्लिअेशन इंसिक्टिअ थॅक्सगिर्विंगना सप्ताडना अंते षुल्लवी रडेशे. कार्यक्रमना समयपत्रकोनी षुष्टि करवा आपना स्थानिक रिक्लिअेशन सेंटरने कृपा करीने झोन करशो, 311 पर कॉल करशो अथवा [ऑनलाईननी](#) मुलाकात लेशो.

(वधु)

आतशबाळ सुरक्षा

थॅक्सगिर्विंग निमित्ते सीटी ओइ ब्रॅम्पटन द्वारा कोई आतशबाळनो कार्यक्रम ढाथ धरातो नथी. वर्षना चार दिवसो ज्यारे सीटी ओइ ब्रॅम्पटनमां अंगत टूकी मर्यादना इटाकडा झोडवानी मंजूरी ढोय छे तेमां थॅक्सगिर्विंगनो समावेश थतो नथी.

सीटी ओइ ब्रॅम्पटनमां इटाकडाना ँपयोग विषयक वधु माडिती माटे 311 पर कॉल करो अथवा www.brampton.ca/bylawsनी मुलाकात लो.

ब्रॅम्पटननुं पुस्तकालय

ब्रॅम्पटन पुस्तकालयनी तमाम शाखाओ (सिविक सेंटरमां यिंगकुळी, सिरिल क्लार्क, झेर कोर्नर्स, गोर मेडोज, माउन्ट प्लेजन्ट विलेज, अने साउथ इलेयर्स) सोमवार, ओक्टोबर 8 ना रोज थॅक्सगिविंग निमित्ते बंध रळेशे. वधु माहिती माटे 905.793.4636 अथवा 311 कॉल करे. अथवा www.bramptonlibrary.ca नी मुलाकात लो.

-30-

मिडिया संपर्क :

नाटाली स्टोगडिल (Natalie Stogdill)

मीडिया रिलेशन्स

सीटी ओफ् ब्राम्पटन

905.874.3654 | natalie.stogdill@brampton.ca